

જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જરી એ શું છે ?

❖ આ એક સુપર સ્પેશીયાલીટી સર્જરી છે. જેમાં રીપેરીંગ નહીં પણ આખા સાંધાનું જ રીપ્લેસમેન્ટ કરવામાં આવે છે. જેમાં મુખ્ય બે સર્જરી પ્રચલિત છે. ની-રીપ્લેસમેન્ટ અને હીપ-રીપ્લેસમેન્ટ.

દીયાળના રીપ્લેસમેન્ટની વાત કરીએ તો ફીમરનું નીચેનું હાડકું અને ટીબીયાના હાડકાને એલોય તથા હાઇન્સીટી પોલી ઈથીલીન નામના પદાર્થથી રીપ્લેસ કરવામાં આવે છે.

આ સર્જરી એ સાંધાનો ખૂલ્લો કરીને કરવાની છે. જેમાં ચોક્કસ પ્રકારના ઓપરેશન થિયેટરની જરૂર પડે છે. જેને અલ્ટ્રાક્લાઇન એર કલાસ ૧૦૦ થિયેટર કહેવાય છે. જ્યાં ઇન્જેક્શનનો રેટ મીનીમમ થઈ જાય છે.

જેના માટે સામાન્ય રીતે પેકેજ ડીલ આપવામાં આવે છે, અને પ્રીઓપરેટીવ અને પોસ્ટ ઓપરેટીવ કેર પણ ખૂબ જ અગત્યની છે.

આ સર્જરીમાં સામાન્યતઃ સાથળની આગળની બાજુ ચીરો મૂકી જોઈન્ટ ખોલી ઢાંકણી સાઈડ પર રાખી ઓપરેશન કરવાનું હોય છે.

☞ આની રીપ્લેસમેન્ટના કયા કયા પ્રકાર છે ?

❖ મુખ્યત્વે બે પ્રકાર છે (૧) ટોટલની રીપ્લેસમેન્ટ  
(૨) પાશીયલની રીપ્લેસમેન્ટ

ટોટલ રીપ્લેસમેન્ટ સાંધાની બને બાજુ સંપૂર્ણ બદલી નાખવામાં આવે છે. જ્યારે પાશીયલ રીપ્લેસમેન્ટમાં માત્ર બગડી ગયેલી સાઈડને રીપ્લેસ કરવામાં આવે છે. જેને કહેવાય છે યુનિકોન્ડાયલર ની રીપ્લેસમેન્ટ.

☞ આ ઓપરેશન કોને કરાવવું પડે છે ?

❖ જ્યારે આર્થાઈસ એવો સીવીયર હોય કે પ્રચલિત પદ્ધતિઓ જેમ કે દવા, ફિઝિયોથેરાપી વગેરે કામ ના કરે અને આર્થાસ્કોપીથી

પણ ફાયદો ના થાય તેવો હોય, દર્દી થોડું ચાલતા જ દુઃખાવો થાય. વધારે સમય ઉભા ના રહી શકાય, પગથિયા ચડવા ઉત્તરવામાં ખૂબ મુશ્કેલી પડે. જ્યારે રેડિયોલોજીકલ રીપોર્ટ પ્રમાણે એમ લાગે કે બંને હાડકા વચ્ચેનું કાર્ટીલેજ ખૂબ વધારે ઘસાઈ ગયું છે ત્યારે ક્વોલીટી ઓફ લાઈફ માટે જ આ ઓપરેશન કરવાનું હોય છે.

અહીં સંપૂર્ણ સાંધો બદલવાનો હોવાથી નાની ઉમરમાં હોય તેવો મજબૂત સાંધો થઈ જાય છે.

☞ આ દર્દીએ ઓપરેશન પછી શું ધ્યાન રાખવાનું હોય છે ?

❖ આ દર્દી પલાંઠીવાળીને બેસવું ના જોઈએ અને -- પગે ના બેસવું જોઈએ. તે કમ્ફેન્ટબલ લાઈફ માટે છે જેથી કરીને દોડવાની, એક્ટીવ સ્પોર્ટ્સ આઉટડોર સ્પોર્ટ્સ વગેરે કે જ્યાં દીયાળમાં હંજરી થવાની શક્યતા છે તે ના કરી શકાય પણ ગોલ્ફ જેવી રમતો રમી શકાય છે. ઘોડેસવારી, કિકેટ, ફુટબોલ, કબડી વગેરે ના રમી શકાય. સાંધાની લાઈફ વધારવી હોય તો નિયમિત કસરત કરી સન્યા મજબૂત બનાવવાના અને શરીરનું વજન ઓછું કરવાનું હોય છે.

☞ વર્દ્ધ હેલ્થ ઓર્ગનાઈઝેશનના આંકડા મુજબ સાંધાઓમાં પડતા ઘસારાના લીધે ડિસએબીલીટીનું સ્થાન ત્રીજાનંબરે છે આવું શા માટે ?

❖ આ માટે જવાબદાર છે આપણી બદલાતી જતી જીવનશૈલી અને ખાવાપીવાની આદતો ઓછામાં ઓછો શ્રમ, વધારે ચરબીવાળો આહાર, કસરતનો અભાવ પણ જવાબદાર છે. પશ્ચિમના દેશોમાં હીપ જોઈન્ટનો આર્થાઈસ ખૂબ જ કોમન છે. જ્યારે આપણા દેશમાં દીયાળનો આર્થાઈસ ખૂબ જ કોમન છે. આ માટેનું કરણ નીચે બેસીને કામ કરવાની પદ્ધતિ પણ જવાબદાર છે. પણ પલાંઠીવાળીને બેસવાથી હીપજોઈન્ટને સારી મૂવમેન્ટમળતી હોવાથી હીપમાં આર્થાઈસ થતો નથી.

આ માટે તો કહેવાય છે કે સાધુ ઔર સાંધા તો ચલતા ભલા. સાંધા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી સારા.

ચાલવાની કસરત માટે સારી ક્વોલીટીની શુશ્રેષ્ઠતા જ ચાલો. ૧૫

- આ ઓપરેશનનો ખર્ચ આશરે કેટલો આવે છે ?
- ❖ સાંધાના ઓપરેશનનો ખર્ચ લગભગ સવા લાખ રૂપિયા જેટલો થાય છે, અને થોડા એનેસ્થેશીયા અને દવાઓના નાના મોટા ખર્ચ થાય છે. જેમાં સૌથી મુખ્ય કિમત સાંધાની હોય છે.
- આ ઓપરેશન સામાન્ય રીતે બંને પગમાં વારા ફરતી કરવાનું હોય છે પણ શું માત્ર એક પગમાં કરીને પણ ફાયદો થાય ?
- ❖ આ ખૂબ જ સરસ સવાલ છે. મોટા ભાગના કેસમાં દર્દી જ્યારે ઢીયણ રીપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવે ત્યારે બંને ઢીયણ ખરાબ થઈ ગયેલા હોય છે. જ્યારે વારા ફરતી બંને પગમાં ઓપરેશન કરાવવું પડે છે.
- એક પગમાં ખૂબ વધારે ઘસારો હોય આવા કેસમાં એવું બને છે કે જે પગ વધારે હુંભતો હોય તેના પર વધારે વજન લઈને ચાલી શકાતું નથી, તેથી કરીને સારા પગ ઉપર વધારાનું વજન આવે છે અને સારા પગ ઉપર પણ ઘસારો શરૂ થઈ જાય છે.
- જે સમયસર વધારે ખરાબ ઢીયણમાં રીપ્લેસમેન્ટ કરવામાં આવે તો દર્દી બંને પગ ઉપર સરખું વજન લઈ શકે છે, અને ખાસ કરીને ચાલવામાં તથા પગથિયાં ચડવા ઉત્તરવામાં પણ વજન સરખા ભાગે વહેંચાઈ જાય છે, જેથી કરીને જે પગ થોડો સારો હતો તે બગડતો અટકી જાય છે.
- આમ કહી શકાય કે એક ઢીયણના ઓપરેશનથી બંનેમાં પણ ફાયદા થાય છે.
- આસ્ટીઓ આર્થાઈસમાં ડોક્ટરો વજન ઓછું કરવાની સલાહ આપે છે તો શું રીપ્લેસમેન્ટ પછી પણ વજન ઓછું કરવું જરૂરી છે ?
- ❖ હા, ચોક્કસ વળી-સામાન્ય રીતે આ બદલાવેલા સાંધાનું આયુષ્ય ૧૨ થી ૧૫ વર્ષનું હોય છે, પણ તે આદર્શ પરિસ્થિતિમાં જેમ કે

સાંધાને કેટલો સાચવવામાં આવે છે. રેગ્યુલર ક્સરતો થાય છે કે નહીં આ ઉપરાંત શરીરની ઉંચાઈ અને ઉમર પ્રમાણે વજન હોવું જરૂરી છે.

જે કારણથી કુદરતી સાંધાઓ ઘસાઈ જાય છે તે જ કારણે જો ચાલુ રાખવામાં આવે તો આ સાંધો પણ ઘસાઈ જવાનો.

જેથી અમે ઓપરેશન પહેલા અને પછી બંનેમાં વજન ઓછું કરવાની સલાહ આપીએ છીએ.

જો ઓપરેશન કર્યા પછી વધારે — વજન ઓછું થઈ શકે છે કારણ હુંખાવો ઓછો થયો હોવાથી ચાલી પણ શકાય છે અને ક્સરત પણ થઈ શકે છે. જો તમે તમારા બદલાવેલા સાંધાની લાઈફ વધારવા માંગતા હોય તો વજન ઓછું કરો. નહીંતર ફરીવાર આ જ ઓપરેશન કરાવવું પડશે.

જુદી બાબા એવી રીતે હુંખાવો અને સોલો (Swelling) બીજો

નિયમ, એસ્ટોમિક્સનો નિયમ નિયમ નિયમ

એસ્ટોમિક્સનો નિયમ એસ્ટોમિક્સનો નિયમ એસ્ટોમિક્સનો નિયમ

**સાંધાનો ઘસારો અટકાવવા  
ટીચણાનો દુખાવો અટકાવવાના ઉપાયો અને  
દ્યાનમાં રાખવાની બાબતો...**

૧. ઉબડ-ભાબડ રસ્તા ઉપર તથા ઢાળ ઉપર ચાલવાનું ટાળો.
૨. ઘરમાં ઓછામાં ઓછા અઠાર ઈંચ ઉંચાઈવાળા ખુરશી-સોફા રાખો.
૩. પગ ફસડાઈ જાય તેવી કારપેટ, લીસી ટાઇલ્સ વગેરે ઘરમાં ન રાખવા.
૪. ઘરમાં જ વારંવાર પગથીયા ચઢવા ઉત્તરવા પડે તેવા સ્પ્લિટ લેવલનું મકાન સલાહ ભરેલું નથી.
૫. ઉભા ઉભા કરવાની કસરતો, દોરડા કુદવાની કસરતો સલાહ ભરેલ નથી.
૬. ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલેની જીવન પદ્ધતિ તમને ખરેખર ખાટલા સુધી લઈ જશે.
૭. બહારગામ જવા માટે ફોલ્ડિંગ કમોડ સ્કુલ જોડે રાખો.

- કોટલ ની-રીલેસમેન્ટ (TKR) કરવાથી શું ફાયદો થાય ?**
- ❖ આ માત્ર એક એવા પ્રકારનું ઓપરેશન છે જેને સંપૂર્ણ સારવાર કહી શકાય. આ ઓપરેશન જો એક જ પગમાં કરવામાં આવ્યું હોય તો બીજા જ દિવસે પેશાન્ટ ફીઝીયોથેરાપીસ્ટની મદદથી ઉભુ થઈ શકે છે અને ત્રીજા દિવસથી વોકરની મદદથી ચાલી શકે છે.
  - છઠા (Sixth) દિવસ પછી દર્દીઓ જાતે પગથીયા ચઢી અને ઉત્તરી શકે છે.
  - થોડા દિવસ વોકર સાથે અને ત્યારબાદ સ્ટીક સાથે ચાલવાનું હોય છે અથવા સ્ટીક વગર પણ ચાલી શકાય છે. આ માટે તમારો બીજો સાંધો (ફીઝશાન) કેવો છે તેના ઉપર આધાર રાખે છે.
  - ઘણીવાર દર્દાને જરૂર પડે તો કન્ટીન્યુસ પેસ્સીવ મોશન ઓફ ધ ની જોઈન્ટ ઓટોમેટીક મશીન (C.P.M. of knee Joint) ઉપર મુકીને કોઈપણ જાતના શ્રમ વગર પગ વાળવાની કસરતો પણ કરી શકાય છે.
  - જેમ સમય થતો જાય તેમ દુઃખાવો અને સોજો (Swelling) ઓછો થાય છે, અને દર્દી વધારે ચાલી શકે છે.
  - શરૂઆતમાં પોતાના ઘરમાં જ અને ત્યારબાદ બહાર ચાલી શકે છે. એકવાર આ ઓપરેશનવાળા પગ ઉપર સામાન્ય વજન લઈ શકવાની શરૂઆત થાય પછી બીજા સાંધામાં પણ રાહત થવાની શરૂઆત થઈ જાય છે.
  - લોકોમાં એવી માચ્યતા છે કે મોટી ઉભરે ઓપરેશન ના કરાવી શકાય ? એ શું સાચી વાત છે.**
  - ❖ ના આ રોગ સામાન્ય રીતે ઉભરને લીધે થતા ઘસારાનો રોગ છે. જે મોટી ઉભરે તેમાં વધારો જોવા મળે છે, વળી જો ૭૦ થી ૭૫ વર્ષની મોટી ઉભરે ઓપરેશન કરાવવામાં આવે તો બાકીની જિંદગી ખૂબ જ સરળતાથી જીવી શકાય છે.

યાદ રહે કે આ ઓપરેશન માત્ર હુંખાવો ઓછો કરવા માટે નહીં  
પણ ક્વોલિટી ઓફ લાઈફ માટે છે.

એકવાર ઓપરેશન થયા પછી ધીમે ધીમે શરીરની બધી જ મૂવમેન્ટ  
વધારે થાય છે. ચાલી પણ વધારે શકાય છે, કાર પણ ચલાવી  
શકાય છે, લાંબો ટાઈમ ઉભા રહી શકાય છે, પગથીયા ચઢી-ઉત્તરી  
શકાય છે.

ચાલી શકવાથી - કાર્ડિયોવાસ્ક્યુલર ફીટનેસ - એરોનીક કેપીસીટી  
સુધરે છે - વજન પણ ઓછું થાય છે.

આમ જોઈએ તો લાંબા સમયે એ સોસીયો ઈકોનોમીકલ  
(Socio-Economical) હેલ્પ કરે છે.

ડાયાબીટીસ સાથે પણ ચોક્કસ સાર-સંભાળ રાખી આ ઓપરેશન  
કરી શકાય છે.

૭૦-૮૫ વર્ષની ઉમરે પણ સાંધા બદલવાના ઓપરેશનથી ફાયદો  
થાય છે અને હવે ઘણાં લોકો આ ઉમરે પણ ઓપરેશન કરાવે છે.

આ ખૂબ જ ખર્ચાળ ઓપરેશન છે ? એવું શા માટે ?

આ ઓપરેશનનો સાંધો (Implant) થોડો મોંધો હોય છે. બાકી  
ઓપરેશન ખર્ચ બીજા ઓપરેશન જેવો જ હોય છે.

વળી લાંબા સમયની દવાઓ, કસરતો, બીજી મુશ્કેલીઓ અથવા  
નાના ઓપરેશનથી બચવાથી પણ ખર્ચમાં લાંબા ગાળે રહીત થાય  
છે. દવાઓ ઓછી થવાથી શરીરમાં બીજી આડ અસર પણ ઓછી  
થઈ જાય છે.

## SANDESH PAEDIATRIC PHYSIOTHERAPY CLINIC



### An exclusive setup for Paediatric Conditions

- (1) Cerebral Palsy
- (2) Infantile Hemiplegia
- (3) Spina bifida
- (4) Torticollis
- (5) Congenital Talipes equino varus
- (6) Congenital dislocation of Hip
- (7) Poliomyelitis
- (8) Erb's Palsy etc.

Treatment is given only by qualified therapist.

Treatment includes -

Neuro Development Therapy (NDT),  
Sensory Integration (SI)

Bobath Approach, Manual Therapy, Orthosis  
Hydro Therapy, Balance Training and  
Prostheses Training, Gait Training,  
Exercise on Gym Ball etc.

**Special Education is given for learning disabled  
children by special educator.**



ફોન : ૨૬૩૦૨૬૪૩,  
૨૬૩૦૪૪૦૧  
(હેલ્પલાઈન)

# અપંગ માનવ મંડળ

ડૉ. વિક્રમ સારાભાઈ માર્ગ, અટીરા પાછળ, અમદાવાદ-૧૫.

શિક્ષણ, સારવાર અને સાધન સંસ્થા દ્વારા વિના મૂલ્યે આપવામાં આવે છે.

## અપંગોત્સ્વી અપંગ માનવ મંડળની વિવિધ પ્રવૃત્તિઓ

૧. ઘો ૧ થી ૭ ની પ્રાથમિક શાળા
૨. ઘો ૮ થી ૧૦ ની માધ્યમિક શાળા
૩. રહેવા જમવાની સુવિધા સાથે કુમાર અને કન્યાઓ માટે  
અલગ અલગ છાત્રાલય.
૪. પ્રિન્ટીંગ, સિલાઈ, એમ્બ્રોઇડરી, સોફ્ટ ટાઇપ, રેક્ઝિન અને  
લેધર વર્કના તાલીમ વગ્ાં.
૫. કોમ્પ્યુટરના વિધિય કોર્સ.
૬. ફીડીયોથેરાપી અને પેડીયાટ્રીક ફીડીયોથેરાપી સારવાર
૭. સ્પાસ્ટીક લન્જિંગ સેન્ટર
૮. ઓપરેશન, સારવાર અને આરોગ્યલક્ષી તપાસ
૯. ઘોડી, કેલીપર્સ, હાથ-પગ વિ. સાધન સહાય
૧૦. ગ્રામ્ય વિસ્તારોમાં નિદાન, સારવાર સાધન સહાય માટે કેમ્પ
૧૧. ઉર્ચય અભ્યાસ શિષ્યવૃત્તિ
૧૨. વિશિષ્ટ કામગીરી અને સિદ્ધિ બદલ એવોર્ડ
૧૩. પુનઃ સ્થાપન કેન્દ્ર
૧૪. લલિતકલા, સાંસ્કૃતિક અને રમત સ્પર્ધા
૧૫. શારીરિક રીતે વિકલાંગો માટે હેલ્પલાઈન